

## ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

### પ્રમાણપત્રો ચકાસણી અંગેની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જા.ક. ૧૫૦/૨૦૧૮૧૯ અન્વયે ગુજરાત સરકારના સચિવાલયના વિભાગો વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે “બિનસચિવાલય કારકુન” અને સચિવાલયના વિભાગો તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ માટે “ઓફિસ આસીસ્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૪/૦૪/૨૦૨૨ના રોજ તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા.૧૯/૦૭/૨૦૨૨ થી તા.૨૩/૦૭/૨૦૨૨ અને તા.૨૫/૦૭/૨૦૨૨ થી તા.૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ હતી. જેમાં લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ઓનલાઇન ચકાસણી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની વિગત નીચે મુજબ છે.

જાહેરાત ક્રમાંક	૧૫૦/૨૦૧૮૧૯
જાહેરાતનું નામ	“બિનસચિવાલય કારકુન” “ઓફિસ આસીસ્ટન્ટ” વર્ગ-૩
દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની લીંક	<a href="https://iass.gujarat.gov.in/">https://iass.gujarat.gov.in/</a>
દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની શરૂ થવાની તારીખ અને સમય	તા.૦૬/૦૯/૨૦૨૨, ૧૧:૦૦ કલાકે
દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની અંતિમ તારીખ	તા.૧૨/૦૯/૨૦૨૨, ૨૩:૫૯ કલાકે

આ માટે ઉમેદવારોએ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.

૧. આ માટે ઉમેદવારોએ <https://iass.gujarat.gov.in/> વેબસાઇટ ઉપર જઈને જાહેરાત ક્રમાંક પસંદ કરી પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાંખીને લોગઈન થવાનું રહેશે.
૨. પ્રમાણપત્રો અપલોડ કરતા પહેલા સ્ક્રીન પર એ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચીને એને અનુસરીને તા. ૦૬/૦૯/૨૦૨૨ થી ૧૩/૦૯/૨૦૨૨ દરમિયાન પોતાના અસલ પ્રમાણપત્રોની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.
૩. અનામત વર્ગના ઉમેદવારોએ પોતાને લાગુ પડતુ અને સમયમર્યાદા દરમિયાન માન્ય હોય તે અસલ, જાતિપ્રમાણપત્ર / નોનકીમીલીયર સર્ટીફિકેટની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

(૧) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી સમયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૨/૦૬/૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક - સશપ/૧૨૨૦૧૫/૪૪૫૨૪૬/અ ની જોગવાઈ મુજબ નોનકીમીલીયર પ્રમાણપત્રની સાથે નિયત નમૂનામાં બાંહેધરી અપલોડ કરવાની રહેશે. (મંડળની વેબસાઇટ ઉપર મૂકેલ બાંહેધરી પત્રક સામેલ રાખવું)

(૨) આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી સમયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૬/૦૬/૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક - ઈડબલ્યુએસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ની જોગવાઈ મુજબ પાત્રતા પ્રમાણપત્રની સાથે નિયત નમૂનામાં બાંહેધરી અપલોડ કરવાની રહે છે. (મંડળની વેબસાઇટ ઉપર મૂકેલ બાંહેધરી પત્રક સામેલ રાખવું)

૪. શારીરિક ખોડખાપણ ધરાવતા (દિવ્યાંગ) ઉમેદવારે પોતાની ખોડખાપણ અંગેનું માન્ય અને એના પ્રમાણ (ખોડખાપણના ટકા) અંગે સ્પષ્ટ વિગતો દર્શાવતું સામાન્ય વહીવટ વિભાગના તા.૧/૧૨/૨૦૦૮ના પરીપત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૦૮-૪૬૯૫૪૦-ગ.૨ (પરિશિષ્ટ-અ) મુજબના નિયત નમૂનામાં અસલ પ્રમાણપત્રની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

૫. વિધવા ઉમેદવારે પુનઃ લગ્ન ન કર્યા અંગેના તાજેતરના અસલ સોગંદનામાની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

૬. ધોરણ-૧૦, ધોરણ-૧૨ કે સમકક્ષ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર રાખેલ ન હોય તો કોમ્પ્યુટરની જાણકારી અંગેના સરકાર માન્ય અસલ પ્રમાણપત્રની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

૭. માજી સૈનિકે સેવામાંથી ડિસ્ચાર્જ કર્યા અંગેની અસલ બુકલેટની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

૮. (સદર જાહેરાત સંદર્ભે) માન્ય રમત કે ખેલકૂદમાં અને માન્ય કક્ષાએ ભાગ લીધો હોય તો તે અંગે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ નિયત નમૂનાના અસલ પ્રમાણપત્રની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

૯. ઉમેદવારે લાગુ પડતા તામામ ડોક્યુમેન્ટ અપલોડ કરી ફરજિયાત લોક કરવાના રહેશે.

૧૦. ઉમેદવારે પોતાની પસંદગીના ખાતા/કચેરી માટેના વિકલ્પ (પ્રેફરન્સ) અત્યારે આપવાના નથી. વિકલ્પ (પ્રેફરન્સ) આપવા માટેની સુચના હવે પછી આપવામાં આવશે. જેથી દરેક ઉમેદવારે મંડળની વેબસાઇટ જોતા રહેવું.

૧૧. મહિલા ઉમેદવાર જો પરિણીત હોય અને અરજીપત્રક અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સરકારી ગેઝેટ કે એફિડેવિટની અસલ પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

૧૨. ઉમેદવાર સરકારી સેવામાં ફીડર કેડરમાં ફરજ બજાવતા હોય તો તેવા ઉમેદવારે તેમની કચેરી/ખાતાનું નોકરીમાં જોડાયા તારીખ/સમયગાળાનું અસલ પ્રમાણપત્ર તથા ના વાંધા પ્રમાણપત્ર (NOC) ની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

૧૩. ઉક્ત સમય મર્યાદામાં દરેક ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો અચુક અપલોડ કરવાના રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

સ્થળ : ગાંધીનગર.

તા: ૫/૦૯/૨૦૨૨

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ